

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ

<https://gpssb.gujarat.gov.in>

બ્લોક નં.૨, પાંચમો માળ, કર્મચોગી ભવન, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર

પ્રોવીઝનલ મેરીટયાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી અંગેની અગત્યની જાહેરાત

૧. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જાહેરાત ક્રમાંક ૧/૨૦૨૧-૨૨ લેબોરેટરી ટેકનીશીયન સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૧૩/૦૩/૨૦૨૨ના રોજ લેવાયેલ હતી. આ સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રોવીઝનલ રીઝલ્ટ અને પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ મંડળ ધ્વારા તા.૦૯-૦૫-૨૦૨૨ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે મંડળની વેબસાઇટ <https://gpssb.gujarat.gov.in> ઉપર મુકવામાં આવેલ છે.

૨. આ પ્રોવીઝનલ મેરીટલીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને નીચે મુજબની વિગતે અસલ પ્રમાણપત્ર ચકાસણી માટે નીચે દર્શાવેલ સ્થળે દરેક ઉમેદવારને ફાળવેલ તારીખ-સમયે જાતે અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે. જે અંગેના ઇમેઇલ, ઉમેદવારે તેની અરજીમાં દર્શાવેલ ઇમેઇલ આઇડી ઉપર મોકલવામાં આવી રહેલ છે. ઉમેદવારને મોકલવામાં આવનાર ઇમેઇલ સાથે પ્રમાણપત્રોની અનુક્રમણિકાની નકલ, એટેસ્ટેશન ફોર્મ (નમુનો-૧), અને ઉમેદવારની શૈક્ષણિક લાયકાતની વિગત દર્શાવતું પત્રક (નમુનો-૨) પણ મોકલવામાં આવશે જે ઉમેદવારે ધ્યાનથી વાંચી -સમજી તેમાં જરૂરી વિગતો ભરીને પ્રમાણપત્ર ચકાસણી વખતે આવવાનું રહેશે.

૩. આથી પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ દરેક ઉમેદવારોને તેમને ફાળવેલ તારીખ/સમયે નીચે દર્શાવેલ પ્રમાણપત્રો સહિત (લાગુ પડતા હોય તે) (અસલ પ્રમાણપત્રો સહિત) ચકાસણી માટે નિયત સ્થળે જાતે અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે. જે પ્રમાણપત્ર ચકાસણીની નિયત તારીખે-સમયે કોઇ ઉમેદવાર ગેરહાજર રહેશે તો સંબંધિત ઉમેદવારે તેની ઉમેદવારી કાયમીપણે પાછી ખેંચી લીધી હોવાનું ગણાશે અને ત્યારપછી તે બાબતમાં કોઇપણ દાવો અથવા વિવાદ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં, તેની સર્વે ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.

ઉમેદવારે રુબરુમાં રજૂ કરવાના પ્રમાણપત્રો (અસલ + સ્વપ્રમાણિત નકલો- બે સેટમાં)

ક્રમ	વિગત
૧	ઉમેદવારની ઓનલાઇન અરજીની પ્રિન્ટ નકલ
૨	એટેસ્ટેશન ફોર્મ (નમુનો-૧)
૩	ઉમેદવારની શૈક્ષણિક લાયકાતની વિગત દર્શાવતું પત્રક (નમુનો-૨)
૪	ધોરણ-૧૦ ની માર્કશીટ અને ટ્રાયલ સર્ટીફિકેટની પ્રમાણિત નકલ
૫	ધોરણ-૧૨ ની માર્કશીટ અને ટ્રાયલ સર્ટીફિકેટની પ્રમાણિત નકલ
૬	શૈક્ષણિક લાયકાત અંગેની માર્કશીટ (વર્ષવાઇઝ/સેમેસ્ટર વાઇઝ માર્કશીટની તમામ નકલો સામેલ રાખવી)
૭	ડીગ્રી સર્ટીફિકેટની પ્રમાણિત નકલ વધારાની લાયકાત અંગેના ડોક્યુમેન્ટ (a Bachelor's degree in chemistry or Microbiology or Bio-chemistry or Bio-technology)
૮	વધારાની ફરજિયાત લાયકાતના પ્રમાણપત્રો (Diploma in Laboratory Technician or Medical Laboratory Technician or Medical Laboratory Technology or P.G. diploma in Medical Laboratory Technology or one year Medical Laboratory Technician Training Course or Laboratory Technician Training Course)ની પ્રમાણિત નકલ
૯	શાળા છોડ્યાનું પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
૧૦	કોમ્પ્યુટરના નોલેજ અંગેનું નિયત પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
૧૧	જાતિ અંગેનું પ્રમાણપત્ર (SC/ST ઉમેદવારના કિસ્સામાં) ની પ્રમાણિત નકલ
૧૨	સા.શૈ.પ ઉમેદવારોના કિસ્સામાં નોનકિમીલેયર પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો) ની પ્રમાણિત નકલ + બાંહેધરીપત્ર અસલમાં રજૂ કરવું.
૧૩	આર્થિક રીતે નબળા વર્ગ(EWS) અંગેનું પ્રમાણપત્રની પ્રમાણિત નકલ + બાંહેધરીપત્ર અસલમાં રજૂ કરવું. (લાગુ પડતું હોય તો)
૧૪	શારીરિક અશક્તતા (દિવ્યાંગ ઉમેદવાર હોવા) અંગેના નિયત પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (લાગુ પડતું હોય તો)
૧૫	માજી સૈનિક હોવા અંગેના આધારો અને ડીસચાર્જ બુકની પ્રમાણિત નકલ (લાગુ પડતું હોય તો)
૧૬	વિધવા હોવા અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (લાગુ પડતું હોય તો)
૧૭	માન્ય રમતગમત (Sports)ના વધારાના ગુણ મેળવવા માટેના નિયત પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (લાગુ પડતું હોય

	તો)
૧૮	ઉમેદવારના આધારકાર્ડની પ્રમાણિત નકલ (ધરાવતા ન હોય તો મેળવેલ નથી તેવું લખવું)
૧૯	ઉમેદવારના પાનકાર્ડ(જો હોય તો)ની પ્રમાણિત નકલ (ધરાવતા ન હોય તો મેળવેલ નથી તેવું લખવું)
૨૦	પાસપોર્ટ સાઇઝના વધારાના બે ફોટા (એક કાગળ ઉપર ચોટાડી તેની નીચે નામ લખી સહી કરી લાવવાના રહેશે.)
૨૧	નામમાં ફેરફાર કરાયેલ હોય તો તે અંગેના સરકારી ગેઝેટ વિગરે આધારોની પ્રમાણિત નકલ(લાગુ પડતું હોય તો)
૨૨	પરિણિત મહિલાના કિસ્સામાં અરજી અને પ્રમાણપત્રોના નામમાં વિસંગતતા હોય તો લગ્ન નોંધણી પ્રમાણપત્રની પ્રમાણિત નકલ, તેમજ એક જ વ્યક્તિ હોવા બદલના સોંઘનામાની પ્રમાણિત નકલ. (લાગુ પડતું હોય તો)

પ્રમાણપત્ર ચકાસણી કાર્યક્રમ

પ્રમાણપત્ર ચકાસણીનું સ્થળ: -

પંચાયત પદાધિકારી તાલીમ કેન્દ્ર, શ્રીમતી ઇન્દીરાગાંધી તાલીમ ભવન, જિલ્લા પંચાયત ભવનની બાજુમાં, સેક્ટર-૧૭

ગાંધીનગર ૩૮૨૦૧૬

પ્રમાણપત્ર ચકાસણીની તારીખ	પ્રમાણપત્ર ચકાસણીનો સમય	પ્રોવીઝનલ મેરીટ લીસ્ટના SR No.
તા.૧૭-૦૫-૨૦૨૨ મંગળવાર	સવારે ૧૧-૦૦ કલાક	૧ થી ૩૦
	બપોરે- ૧૫-૦૦ કલાક	૩૧ થી ૬૦
તા.૧૮-૦૫-૨૦૨૨ બુધવાર	સવારે ૧૧-૦૦ કલાક	૬૧ થી ૯૦
	બપોરે- ૧૫-૦૦ કલાક	૯૧ થી ૧૨૦
તા.૧૯-૦૫-૨૦૨૨ ગુરુવાર	સવારે ૧૧-૦૦ કલાક	૧૨૧ થી ૧૫૦
	બપોરે- ૧૫-૦૦ કલાક	૧૫૧ થી ૧૮૦
તા.૨૦-૦૫-૨૦૨૨ શુક્રવાર	સવારે ૧૧-૦૦ કલાક	૧૮૧ થી ૨૧૦
	બપોરે- ૧૫-૦૦ કલાક	૨૧૧ થી ૨૪૦
તા.૨૧-૦૫-૨૦૨૨ શનિવાર	સવારે ૧૧-૦૦ કલાક	૨૪૧ થી ૨૭૦
	બપોરે- ૧૫-૦૦ કલાક	૨૭૧ થી ૩૦૦
તા.૨૪-૦૫-૨૦૨૨ મંગળવાર	સવારે ૧૧-૦૦ કલાક	૩૦૧ થી ૩૩૦
	બપોરે- ૧૫-૦૦ કલાક	૩૩૧ થી ૩૬૦
તા.૨૫-૦૫-૨૦૨૨ બુધવાર	સવારે ૧૧-૦૦ કલાક	૩૬૧ થી ૩૯૦
	બપોરે- ૧૫-૦૦ કલાક	૩૯૧ થી ૪૨૦
તા.૨૬-૦૫-૨૦૨૨ ગુરુવાર	સવારે ૧૧-૦૦ કલાક	૪૨૧ થી ૪૫૦
	બપોરે- ૧૫-૦૦ કલાક	૪૫૧ થી ૪૮૦
તા.૨૭-૦૫-૨૦૨૨ શુક્રવાર	સવારે ૧૧-૦૦ કલાક	૪૮૧ થી ૫૧૦
	બપોરે- ૧૫-૦૦ કલાક	૫૧૧ થી ૫૪૦
તા.૩૦-૦૫-૨૦૨૨ સોમવાર	સવારે ૧૧-૦૦ કલાક	૫૪૧ થી ૫૭૦
	બપોરે- ૧૫-૦૦ કલાક	૫૭૧ થી ૬૦૦
તા.૩૧-૦૫-૨૦૨૨ મંગળવાર	સવારે ૧૧-૦૦ કલાક	૬૦૧ થી ૬૩૬
તા.૦૧-૦૬-૨૦૨૨ બુધવાર	સવારે ૧૧-૦૦ કલાક	૬૩૭ થી ૬૫૮

“મંડળના આદેશાનુસાર”

તારીખ:- ૧૨-૦૫-૨૦૨૨

સચિવ